

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ  
છશ્લેમાળ, ગીફ્ટ વન, રોડ-૫-સી, ઝોન-૫, ગીફ્ટ સીટી,  
ગાંધીનગર-૩૮૨૩૫૫, ગુજરાત

### જાહેર નોટીસ

લાઇસન્સ અરજી નં.૧/૨૦૧૮

૨૦૦૩ના વીજળી અધિનિયમ(૨૦૦૩નો નં.૩૬) ની કલમ-૧૫  
ની પેટા કલમ(૫)ના ખંડ (એ) અન્વયે નોટીસ :

૧. કંપની અધિનિયમ ૧૯૫૬ હેઠળ સંસ્થાપિત ટોરેન્ટ પાવર લિમિટેડ,  
“સમન્વય”, ૬૦૦, તપોવન, આંબાવાડી, અમદાવાદ-  
૩૮૦૦૧૫, એ Dholera Special Investment Region (DSIR), જે  
Industries and Mines Department, Government of Gujarat ના પરિપત્ર  
નં.GHU-14/SIR/112009/253/(1)/I તારીખ 2/05/2009 મુજબ Industrial  
Township તરીકે જાહેર કરવામાં આવેલ છે. તે વિસ્તારમાં વીજળી  
વિતરણ વ્યવસ્થાની સ્થાપના, શરૂઆત, ગોઠવણ, સંચાલન તથા  
જાળવણી દ્વારા વિજ વિતરણ ધંધો હાથ ધરવા વીજળી વિતરણ  
લાઇસન્સ આપવા માટે વીજળી અધિનિયમ(અધિનિયમ-૨૦૦૩) ની  
કલમ-૧૫ ની પેટા કલમ(૧) અન્વયે અરજી કરી છે. પ્રસ્તુત અરજી  
તથા આયોગનો તા.૨૧/૦૪/૨૦૧૮ નો મૌખિક આદેશ આયોગની વેબ  
સાઇટ, [www.gercin.org](http://www.gercin.org) પર મૂકવામાં આવ્યો છે.

૨. અરજદારે તા.૩૧/૦૧/૨૦૧૮ના રોજ “Indian Express”, “દિવ્ય  
ભાસ્કર” અને “નવગુજરાત સમય” માં લોકો પાસેથી વાંધા મંગાવવા  
માટે અધિનિયમની કલમ-૧૫ ની પેટા કલમ(૨) અન્વયે નોટીસ પ્રસિદ્ધ  
કરી હતી.

૩. આયોગને Uttar Gujarat Vij Company Limited, Paschim Gujarat  
Vij Company Limited અને Gujarat Energy Transmission  
Corporation Limited પાસેથી વાંધાઓ મળ્યા છે અને આયોગે તેની  
વિચારણા કરી છે.

૪. રેકર્ડ ઉપર ઉપલબ્ધ સામગ્રી વિચારણામાં લઈને આયોગે ટોરેન્ટ  
પાવર લિમિટેડ, “સમન્વય”, ૬૦૦, તપોવન, આંબાવાડી,  
અમદાવાદ-૩૮૦૦૧૫, ને Dholera Special Investment Region (DSIR),  
જે Industries and Mines Department, Government of Gujarat ના  
પરિપત્ર નં.GHU-14/SIR/112009/253/(1)/I તારીખ 2/05/2009 મુજબ  
Industrial Township તરીકે જાહેર કરવામાં આવેલ છે, તે વિસ્તારમાં  
વીજળી વિતરણ વ્યવસ્થાની સ્થાપના, શરૂઆત, ગોઠવણ, સંચાલન  
તથા જાળવણી દ્વારા વિજ વિતરણ ધંધો હાથ ધરવા વીજળી વિતરણ  
લાઇસન્સ આપવા માટે વીજળી અધિનિયમ(અધિનિયમ-૨૦૦૩) ની

કલમ-૧૫ ની પેટા કલમ(૧) અન્વયે અરજી કરી છે. તે વિસ્તારમાં વીજળી વિતરણ વ્યવસ્થાની સ્થાપના, શરૂઆત, ગોઠવણ, સંચાલન તથા જાળવણી દ્વારા વિજ વિતરણ ધંધો હાથ ધરવા વીજળી વિતરણ લાઇસન્સ આપવા માટે આયોગે જાહેર કરેલ વીજળી વિતરણનું લાઇસન્સ આપવા અંગેની (૨૦૦૫ના જાહેરમનામા નં.૪) વીજ વિતરણ લાઇસન્સ આપવાની જોગવાઈઓ અનુસાર ટોરેન્ટ પાવર લિમિટેડ, "સમન્વય", ૬૦૦, તપોવન, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫ને આયોગ દ્વારા જાહેર કરાયેલ વીજળી વિતરણ લાઇસન્સ વિનિયમ અને વીજળી અધિનિયમ-૨૦૦૩ની જોગવાઈઓ અનુસાર વિતરણ લાઇસન્સ આપવા માટે વિચારવામાં આવ્યું છે.

૫. આ નોટીસ ૨૦૦૩ના વીજળી અધિનિયમની કલમ-૧૫ની પેટા કલમ-(૫)માં ખંડ(એ) અન્વયે આયોગ ઉપરના ફકરા નંબર (૪) ફકરા-૪ માં ઉપર દર્શાવ્યા પ્રમાણે વીજળી વિતરણ માટે ટોરેન્ટ પાવર લિમિટેડ ને Dholera Special Investment Region માં વિતરણ લાઇસન્સ આપવાની આયોગના ઇરાદા સામે કોઈ વાંધો કે સૂચનો હોય તો તે નીચે સહી કરનારને ઉપર દર્શાવેલ સરનામે એકિડેવિટ કરાવી છ(ક) નકલમાં તા. ૧૫/૦૫/૨૦૧૮ સુધીમાં મોકલી આપવા અને તેમાં પૂરૂ નામ, ટપાલનું સરનામું તથા ઇમેઇલ એડ્રેસ હોય તો તે લખવા.

૬. આ બાબતની સુનાવણી ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ, છબ્રેમાળ, ગીફ્ટ વન, રોડ-૫-સી, ઝોન-૫, ગીફ્ટ સીટી, ગાંધીનગર-૩૮૨૩૫૫, ગુજરાતની કચેરીએ તા. ૧૮/૦૫/૨૦૧૮ ના રોજ સવારે ૧૧.૩૦ કલાકે રાખેલ છે.

સહી/-

(રૂપવંતસિંહ, આઇ.એ.એસ.)

સચિવ

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ

સ્થળ : ગાંધીનગર

તા. ૨૪/૦૪/૨૦૧૮